



MBZ-201411

Seat No. _____

M. A. (Education) (Sem. II) (CBCS) Examination

April / May - 2018

Research Methodology - II
(New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70

- ૧ નીચેના દરેક પ્રશ્નનો ટૂંકમાં જવાબ લખો : ૧૬
- (૧) ઓળખ માપ પદ્ધતિ એટલે શું ?
- (૨) નમૂનો એટલે શું ?
- (૩) અનુક્રમ માપ પદ્ધતિ એટલે શું ?
- (૪) સળંગસૂત્રી સંશોધન પદ્ધતિ સમજાવો.
- (૫) આડછેદી સંશોધન પદ્ધતિ એટલે શું ?
- (૬) પ્રાયોગિક સંશોધન પદ્ધતિ એટલે શું ?
- (૭) ઝૂમખાં નમૂના પસંદગી સમજાવો.
- (૮) ગુણાત્મક સંશોધન એટલે શું ?
- ૨ નીચેના પ્રશ્નોના ઉત્તર આપો : (કોઈપણ આઠ) ૨૪
- (૧) ઐતિહાસિક સંશોધન પદ્ધતિ સમજાવો.
- (૨) કારણ-તુલનાત્મક સંશોધન પદ્ધતિ સમજાવો.
- (૩) નમૂનાની પ્રમાણભૂલ એટલે શું ?
- (૪) પ્રાથમિક અને ગૌણ સંદર્ભ સ્થાપનોના ઉદાહરણ આપો.
- (૫) ગુણાત્મક સંશોધન માટેના ઉપકરણ સમજાવો.
- (૬) દસ્તાવેજ સર્વેક્ષણ સમજાવો.
- (૭) વ્યાપવિશ્વ વિશે નોંધ લખો.
- (૮) આંશિક પ્રાયોગિક યોજનાઓ એટલે શું ?
- (૯) વ્યક્તિ-અભ્યાસ પદ્ધતિ સમજાવો.
- (૧૦) વિકાસાત્મક સંશોધન પદ્ધતિનાં લાભાલાભ જણાવો.

- ૩ નીચેના પ્રશ્નોના વિસ્તૃત ઉત્તર આપો : (કોઈ પણ છ)
- ૩૦
- (૧) પ્રાયોગિક સંશોધન પદ્ધતિ સમજાવો.
 - (૨) સંખ્યાત્મક અને ગુણાત્મક સંશોધનોનો તફાવત જણાવો.
 - (૩) નમૂના પસંદગી એટલે શું ? સારા નમૂનાની લાક્ષણિકતાઓ લખો.
 - (૪) કોઈ એક સંશોધન સમસ્યા પસંદ કરી, સર્વેક્ષણ સંશોધન પદ્ધતિથી તે સંશોધન સમસ્યા હાથ ધરવાના સોપાનો જણાવો.
 - (૫) ગુણાત્મક સંશોધન પદ્ધતિ સમજાવો.
 - (૬) વ્યક્તિ અભ્યાસ પદ્ધતિનાં સોપાનો સમજાવો.
 - (૭) સ્તરીકૃત આકસ્મિક નમૂના પસંદગીના લાભાલાભ જણાવો.
 - (૮) પ્રાયોગિક યોજનાઓ સમજાવો.

ENGLISH VERSION

- 1 Write the answer of the all following questions : 16
- (1) What is Nominal Scale ?
 - (2) What is Sample ?
 - (3) What is Ordinal Scale ?
 - (4) Explain Longitudinal research method.
 - (5) What is Cross sectional study method.
 - (6) What is Experimental research ?
 - (7) Explain : Cluster Sampling Technique.
 - (8) What is qualitative research ?
- 2 Answer questions of the following : (any eight) 24
- (1) Explain Historical Research Method.
 - (2) Explain Causal Comparative Research Method.
 - (3) What is Sampling Error ?
 - (4) Explain examples of Primary and Secondary resources.
 - (5) Explain Tools for qualitative research.
 - (6) Explain Documentary analysis.
 - (7) Explain Universe.
 - (8) What is Quasi Experimental Designs ?
 - (9) Explain Case study method.
 - (10) Explain Advantages and Disadvantages of development research method.

3 Answer in detail : (any **six**)

30

- (1) Explain Experimental research method.
 - (2) Explain the difference between numerical and qualitative research.
 - (3) What is Sample selection ? Explain features of good sample.
 - (4) Select any one problem and state steps of survey method to handle that problem.
 - (5) Explain qualitative research.
 - (6) Explain steps for case study research.
 - (7) State advantages and disadvantages of random sampling method.
 - (8) Explain experimental plans.
-